

GJSK040008592026



મુદામાલ અરજ નં.૧૧૧/૨૦૨૬

ઇડર પો.સ્ટે. નં.૩૧૧૦૭૨૫૦૧૪૭૩૭૬/૨૦૨૫

અરજદાર મહેશભાઈ નાથાભાઈ પટેલની ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ ની કલમ-૪૯૭ અને ૫૦૩ ની અરજી હેઠળ હુકમ

- (૧) અરજી વંચાણે લીધી, સાંભળ્યા.
- (૨) આ કામે અરજદારે હાલની અરજી કરીને અરજ ગુજારેલ છે કે, અરજદારના બેન્ક નામે બેન્ક ઓફ બરોડા(ઇન્કલુડીંગ વિજયા બેન્ક એન્ડ દેના બેન્ક)ના ખાતા/ક્રેડીટ કાર્ડ નં.૧૩૬૫૦૧૦૦૦૦૭૪૩૬ માંથી રૂ. ૪૫,૦૦૦/- આમ કુલ રૂ.૪૫,૦૦૦/- ઉપડી ગયેલ હતા જે બાબતે ફરીયાદીએ ૧૯૩૦ નંબર ઉપર કોલ કરીને ફરીયાદ નોંધાવેલ હતી જેની તા.૨૮/૦૭/૨૦૨૫ ના રોજ ફરીયાદ નં.૩૧૧૦૭૨૫૦૧૪૭૩૭૬ થી નોંધાયેલ છે. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ ધ્વારા સામેવાળાના ખાતામાં ફરીયાદીના ગયેલ નાણાં પૈકી અમુક રૂપિયા બી.એન.એસ.એસની કલમ-૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા. જે હાલ સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને પરત મળેલ નથી અને અરજદારનું ખાતુ ફીઝ થયેલ છે. આ બાબતે એફ.આઈ.આર. થયેલ નથી અને અરજદારને આર્થિક રીતે નુકશાન થાય તેમ છે. સદર રૂપિયાથી અરજદારને ગુજરાન ચલાવવા ખુબ જ જરૂરીયાત હોય જેથી સદર નાણાં બેન્ક ખાતુ ફીઝ થયેલ છે તો બેન્ક ખાતુ અનફીઝ કરવા તેમજ અરજદારના ખાતામાં પરત મેળવવા હાલની આ અરજી કરેલ છે. સદરનું નાણાં અરજદારના છે. તે બતાવવા ફરીયાદ નં. ૩૧૧૦૭૨૫૦૧૪૭૩૭૬ ની નકલ, પોલીસે બેન્ક ઓફ ઇન્ડિયાને આપેલ નોટીસ, પાનકાર્ડ તથા આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, ફરીયાદીના બેન્કની સ્ટેટમેન્ટની નકલ રજુ કરેલ છે અને સદરનું નાણાં અરજદાર અંગત ઉપયોગ સાડ જરૂર હોય તે પરત સોંપવા અરજ ગુજારેલ છે.

(૩) અરજી સંદર્ભે પોલીસ અભિપ્રાય વંચાણે લેતાં, અરજદારશ્રીનાઓના સામાવાળા શંકાસ્પદ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતા નં.૨૦૫૯૨૦૧૧૦૦૦૧૦૦૪ માં ગયેલ રૂ.૨૦,૦૦૦/- અરજદારના નાણાં તે ફીઝ થયેલ છે. સદર બેન્ક ખાતાઓ શંકાસ્પદ હોવાનું જણાઈ આવે છે અને સદરનું ખાતું સીઝ કર્યા બાદ શંકાસ્પદ બેન્ક ખાતા ધારકોને અત્રેના પોલીસ સ્ટેશનથી તા.૧૪/૧૧/૨૫ ના રોજ બેન્ક મારફતે ઇમેલ કરી દિન-૭ માં કોઈ રજુઆત હોય તો અત્રેના પોલીસ સ્ટેશન સંપર્ક કરવા જણાવેલ હોવા છતાં ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબત અમારા સમક્ષ કોઈ વાંધા તકરાર જણાવેલ નથી. જેથી તે રૂપિયા અરજદારશ્રીને બેન્ક ઓફ બરોડા(ઇન્કલુડિંગ વિજયા બેન્ક એન્ડ દેના બેન્ક)ના ખાતા નં.૧૩૬૫૦૧૦૦૦૦૭૪૩૬ IFSC CODE નં.BARB0JAWANP માં પાછા આપવા તેમનો સ્પષ્ટ અભિપ્રાય છે.

(૪) અરજદાર તરફે પોતાની અરજીમાં જણાવ્યા મુજબ ફીઝ કરેલ મુદામાલ નાણાં બાબતે તે બતાવવા ફરીયાદ નં. ફરીયાદ નં. ૧૩૬૫૦૧૦૦૦૦૭૪૩૬ ની નકલ, પોલીસે બેન્ક ઓફ ઇન્ડિયાને આપેલ નોટીસ, પાનકાર્ડ તથા આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, ફરીયાદીના બેન્કનું સ્ટેટમેન્ટની નકલ રજુ કરેલ છે. આમ, રજુ થયેલ દસ્તાવેજોના આધારે અરજદાર અરજીમાં જણાવેલ રોકડ રકમના માલીક હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે.

(૫) વધુમાં, આ કામે પોલીસ અભિપ્રાય તેમજ તે સાથે રજુ દસ્તાવેજ પુરાવા ધ્યાને લીધા. અરજદારની અરજી ધ્યાને લેતાં મુદામાલ નાણાં જો વધુ સમય બેન્કમાં ફીઝ પડી રહે તો અરજદારને નુકશાન થાય તેમ જણાય છે અને હાલના અરજદારએ માલીક હોવાનું ફલીત થતું હોય આ મુદામાલ પરત સોંપવો યોગ્ય અને વાજબી હોવાનું માનુ છું.

આમ, આ સંજોગોમાં મુદામાલ અરજદારને પરત સોંપવામાં આવે તો તે યોગ્ય અને વ્યાજબી હોવાનું જણાઈ આવતું હોઈ યોગ્ય શરતોને આધિન યોગ્ય રકમના જામીન અને જાત મુચરકો રજુ કર્યેથી અરજદારને મુદામાલ નાણાં પરત સોંપવા ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

:: હુકમ ::

૧. આથી અરજદાર મહેશભાઈ નાથાભાઈ પટેલ, રહે.મણિયોર, તા.ઈડર,

જી.સાબરકાંઠાનાઓની મુદામાલ પરત મેળવવાની અરજી મંજૂર કરવામાં આવે છે.

૨. અરજદારશ્રી મહેશભાઈ નાથાભાઈ પટેલનાઓના સામાવાળા શંકાસ્પદ બેન્ક ઓફ ઈન્ડિયા ખાતા નં.૨૦૫૯૨૦૧૧૦૦૦૧૦૦૪ માં ગયેલ રૂ.૨૦,૦૦૦/- ફીઝ થયેલ છે તે ખાતુ અનફીઝ કરવા તેમજ સદર ખાતામાંથી તે રૂપિયા અજદારશ્રીને બેન્ક ઓફ બરોડા(ઈન્કલુડીંગ વિજયા બેન્ક એન્ડ દેના બેન્ક)ના ખાતા નં.૧૩૬૫૦૧૦૦૦૦૭૪૩૬ IFSC CODE નં.BARB0JAWANP માં વચગાળાની કસ્ટડીએ પાછા સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

શરતો :-

- ૧) અરજીમાં જણાવેલ શંકાસ્પદ બેન્ક ઓફ ઈન્ડિયા ખાતા નં.૨૦૫૯૨૦૧૧૦૦૦૧૦૦૪ માં સ્થગીત થયેલ રકમ અરજદારે સંબંધીત પોલીસ સ્ટેશનમાં તેટલીજ રકમના જામીન તથા તેટલી જ રકમનો જાતમુચરકો રજુ કરેથી પરત કરવાનો હુકમ કરવામાં આવે છે.
- ૨) અરજદારે પોલીસ સ્ટેશનમાં જામીન રજુ કરેથી પોલીસે સ્થગીત કરેલ રકમ પરત કરવા જે તે સંબંધીત ખાતાવાળી બેન્કને ચાદી કરવાનો આદેશ આપવામાં આવે છે.
- ૩) જો સદર રકમનો અન્ય કોઈ વ્યક્તિ કલેઈમ કરશે કે અન્ય વ્યક્તિની જણાઈ આવશે તો સદર રકમ અરજદારે અત્રેની કોર્ટમાં જમા કરાવાની રહેશે.

હુકમ આજરોજ તા.૦૬-૦૭-૨૦૨૬ ના રોજ ખુદી અદાલતમાં વાંચી, સંભળાવી, સહી કરી જાહેર કર્યો.

સ્થળ: ઇડર
તા.૦૬/૦૭/૨૦૨૬

(ડા.સ્તુતિ.ડી.કાપડીયા)
એડી.ચીફ જ્યુડી. મેજ.મુ.ઇડર
જજ કોડ નં.જ.જે ૦૧૩૫૬

//Mahavir//